

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૮/૯/૨૦૧૬ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૧૬૪૦/૧૬

શહેરકોટડા પોલીસ સ્ટેશન :

એફ.સી.આઇ માં ખોટા દસ્તાવેજોથી નોકરી અપાવનાર બે આરોપીઓની ધરપકડ

દેશ વ્યાપી કોભાડની શક્યતા

આજરોજ શહેરકોટડા પો.સ્ટેશનના સર્વેલન્સ પો.સ.ઇ એન.આર.મકવાણા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ગુપ્ત બાતમીના આધારે આજરોજ કલાક ૧૪/૩૦ વાગે કાલુપુર મીટર ગેજ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં-૧૨ ની બહારના ભાગે બે ઇસમો વિવેકકુમાર રામઆશિષ ઉપાધ્યાય ઉવ-૨૩ રહે, ગામ-કરમાવા થાના-ઢાકા જીલ્લો-પુર્વ ચંપારણ બિહાર તથા (૨) રીતેષ રોશન @ આશુ સચ્ચિદાનંદ શ્રીવાસ્તવ ઉવ-૨૧ રહે, મ.નં-૨૮ ગૌતમ રોડ વિદ્યાપતિનગર બારીદાર જી-જમશેદપુર ઝારખંડ નાઓની અટકાયત કરવામાં આવેલ છે.

આરોપીઓની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે ઉપરોક્ત પકડાયેલ બન્ને આરોપીઓ વાંકાનેરમાં છ માણસોને એફ.સી.આઇ માં ખોટા દસ્તાવેજ આધારે નોકરી અપાવીને પરત પોતાના વતનમાં જતા હતા જે પૈકી આરોપી વિવેકકુમારનાએ પુના મહારાષ્ટ્ર ખાતે મીકનીકેલ ડિપ્લોમાનો બે વર્ષનો કોર્સ કરેલાનું જણાઇ આવેલ છે તેના પિતાજી આર્મીમાંથી નિવૃત્ત થયેલ છે આરોપી તેના વતન બિહારમાં આધાર કાર્ડ બનાવવાનું કામ કરતો હતો ત્યારબાદ બેકાર હતો દરમિયાન બેકમાં નોકરી આપવવાના કામમાં ત્રીસ થી ચાલીસ લાખનું નુકશાન થયેલ ત્યારબાદ તેને દિલ્હીમાં મહેન્દ્ર નામના માણસ સાથે ઓળખાણ થયેલ અને તેના દ્વારા અદાલત પાસવાન જે વાંકાનેરમાં એફ.સી.આઇ માં કામ કરે છે તેની સાથે ઓળખાણ થયેલ તેઓની સાથે મળીને ખોટા ડોક્યુમેન્ટ સિક્કા (પુરાવા) બનાવી પોતાના વતનમાંથી છોકરાઓને નોકરી લગાવવાનું ચાલુ કરેલ જેમા દર ઉમેદવાર દીઠ ચાલીસ હજાર રૂપિયા લેતા જેમાથી દસ હજાર પોતાના તથા ત્રીસ હજાર મહેન્દ્ર અને અદાલતને આપતો હતો તેને ચંદીગઢમાં ચાર અને વાંકાનેરમાં છ જણાને નોકરી લગાડેલ હોવાનું જણાવેલ છે.

બીજો આરોપી રીતેષ રોશન @ આશુ સચ્ચિદાનંદ શ્રીવાસ્તવ આરોપી વિવેકકુમાર ઉપાધ્યાયનો મિત્ર છે અને તે પણ આરોપીની સાથે આ વખતે વાંકાનેર ખાતે છ પૈકી ત્રણ ઉમેદવાર લઇને આવેલ અને તેના દસ થી વીસ લાખ રૂપિયા લીધેલ જે પૈકી નેવ હજાર રૂપિયા અદાલતને આપેલ અને બાકીના ત્રીસ હજાર તેને લીધેલાનું જણાઇ છે.

ઉપરોક્ત બન્ને આરોપીઓ પાસેથી સાત રબર સ્ટેમ્પ જેમા (૧) એચ.પી.સિંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ (૨) કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હેન્ડલીંગ વર્કસ (૩) યુનિયનના સિક્કા (૪) ઉત્તરપ્રદેશ રાજ્ય ભંડાર નિગમ સંસ્થાન હેન્ડલીંગ મજદુર યુનિયન બરેલી યુ.પી (૫) સેન્ટ્રલ વેર-હાઉસીંગ કોર્પોરેશન યુનિયન વર્કસ (૬) મહાસચિવ (૭) કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વાંકાનેર જોઇનીંગ લેટર, કુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હેન્ડલીંગ વર્કસના આઇ-કાર્ડ કોરા નંગ-૧૦, સ્ટેમ્પ પેપર કોરા નં-૦૩ મળી આવેલ છે તથા આરોપીઓ પાસેથી કોઇપણ સિક્કો બનાવવાની એક કીટ મળી આવેલ છે જેનાથી જે સિક્કો જોઇએ તે તાત્કાલિક બનાવી શકાય છે આરોપીઓ વિરુદ્ધમાં વાંકાનેર મુકામે ગુન્હો દાખલ થયેલ હોય આરોપીઓને તેઓને સોંપવાની આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.